



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની જાહેરાત

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામા આવેલ નાચે મુજબની જાહેરાતની પ્રાથમિક કસોટી તારીખ- ૧૩/૧૦/૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્યના ૩૨ જિલ્લામાં વિવિધ પેટા કેન્દ્રો ખાતે યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ <https://gpsc.gujarat.gov.in/> પર ઉપલબ્ધ છે.

ક્રમ	જગ્યાનું નામ	જાહેરાત ક્રમાંક	પ્રાથમિક કસોટી તારીખ અને સમય	પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧	ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ તથા વર્ગ-૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨	૧૦/૨૦૧૯-૨૦	તા-૧૩/૧૦/૨૦૧૯ પેપર-૧-સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ પેપર-૨-બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦	૨૭/૦૯/૨૦૧૯ ૧૩:૦૦ કલાકથી

ઉપરોક્ત જાહેરાતમા જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ છે તેવા તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગ નિર્ણય કરેલ છે. ઉપર્યુક્ત જાહેરાતના સંબંધિત ઉમેદવારોએ કોલમ-૫ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાક થી પરીક્ષાના દિવસે સવારે ૧૦:૦૦ સુધીમાં પોતાના પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) "Online" ડાઉનલોડ કરવાના રહેશે. પ્રવેશપત્ર "Online" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્તેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે (૧) <https://gpsc-ojas.gujarat.gov.in> પર જવું. (૨) "Call Letter / Form" >> "Preliminary Exam Call Letter" પર "Click" કરવું. (૩) અહીં ઉમેદવારે પોતાની "Job Select" કરવી તથા "Confirmation Number" અને "Birth Date" ટાઈપ કરવાના રહેશે. (૪) હવે "Print Call Letter" પર "Click" કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પ્રવેશપત્રમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર "Click" કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચૂક કાઢવામાં આવે તેની નોંધ લેવી. પ્રવેશપત્ર અને પરિશિષ્ટ-૧&૨ની અલગ અલગ કાગળ પર પ્રિન્ટ કરવાના રહેશે. પરીક્ષા સમયે બંને સાથે લાવવાના રહેશે. જે ઉમેદવારોના ફોટો પ્રવેશપત્રમાં સ્પષ્ટ જોઈ શકાય તેવા આવેલા ન હોય તેવા ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટો પરીક્ષા કેન્દ્ર પર લાવવાનો રહેશે. આ ફોટો ઉમેદવારનો પોતાનો છે તેની સ્પષ્ટતા માટે ફોટોવાળું ઓળખપત્ર સાથે રાખવું આવશ્યક છે.

નોંધ:- સદરહુ પ્રાથમિક કસોટીના દિવસે ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં સવારે ૦૯:૩૦ કલાકે અચૂક હાજર થવાનું રહેશે.

ખાસ નોંધ:- પોસ્ટ ઓફિસમાં/ઓનલાઇન અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રથમ આયોગની કચેરી (સરનામું: એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, 'છ' રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમા આવી પ્રોસેસ આજ રૂ.૫૦૦/- રોકડથી ભરવાના રહેશે. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય, છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઇટ પર "Application Not Found" નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. તારીખ-૨૭/૦૯/૨૦૧૯

follow us on: [@GPSC OFFICIAL](https://gpsc.gujarat.gov.in) <https://gpsc.gujarat.gov.in> GPSC (Official)